

B.A. Semester - 6 (CBCS) Examination

Oct/Nov -2020

ECONOMICS : P22 BANKING AND FINANCIAL MARKET - 2(CORE - 22)

Time: 2:00 Hours

Marks: 56

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any four of the following questions.

-
- પ્રશ્ન.૧ ભારતમાં બેન્કિંગ માળખાનું મૂલ્યાંકન કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૧ નાબાર્ડ નાં હેતુઓ અને કામગીરી સમજાવો.
- પ્રશ્ન.૨ ભારતમાં વ્યાપારી બેંકો નાં રાષ્ટ્રીયકરણ ના કારણોની ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૨ ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની મર્યાદાઓ સમજાવો.
- પ્રશ્ન.૩ મુડી બજારનો અર્થ આપી, મુડીબજારના સાધનો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૩ મુડીબજાર એટલે શું? ભારતમાં મુડીબજારનું મહત્વ ચર્ચો.
- પ્રશ્ન.૪ ભારતમાં બિન-બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનાં હેતુઓ અને કાર્યો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૪ રિઝર્વબેન્કના શાખા નિયંત્રણ ના હેતુઓ સમજાવો.
- પ્રશ્ન.૫ ટૂંકનોંધ લખો. (ગમે તે બે) (૧૪)
1. ભારતમાં ખાનગી બેંકો નું મહત્વ.
 2. રાષ્ટ્રીકૃત બેંકો નું મહત્વ.
 3. SEBI નાં કાર્યો.
 4. રીઝર્વબેંક ની વર્તમાન નીતિ.

ENGLISH VERSION

- Q.1 Evaluate Banking structure in India. (14)
OR
- Q.1 Explain objective and function of NABARD.
- Q.2 Discuss, reasons of nationalization of commercial banks in India. (14)
OR
- Q.2 Explain limitations of nationalized banks in India.
- Q.3 Give meaning of capital market, and Explain instrument of capital market. (14)
OR
- Q.3 What is capital market? Discuss importance of capital market in India.
- Q.4 Explain objectives and functions of Non-banking financial institutions in India. (14)
OR
- Q.4 Explain objectives of credit control of Reserve bank of India.
- Q.5 Write short note. (any two) (14)
1. Importance of private banks in India.
 2. Importance of nationalized banks.
 3. Functions of SEBI.
 4. Recent policy of Reserve bank.
